



જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૨/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૭૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૧ કેસ કરી, ૫૬ વ્યક્તિઓને ઝડપી, ૫૦ લીટર દેશી દારૂ, ૦૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૦૧ બિયર ટીન અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી, ૧૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૪,૮૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૭૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૦૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિની અટકાયત કરી હતી.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૭૯/૧૯

નિકોલ : દિનેશભાઈ ખોડાભાઈ પટેલ (રહે, ન્યુ અરવિંદપાર્ક સોસાયટી, ચંદ્રપ્રસાદ દેસાઈ હોલની સામે બાપુનગર) એ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૨/૧૯ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે નિકોલ રસરાજ જેકપોટ-૧ ના ખુલ્લા મેદાનમાં રાખેલ લગ્ન મંડપમાં (૧૦ થી ૧૨ વર્ષના આશરાનો અજાણ્યો છોકરો) એ દિનેશભાઈની દિકરીના લગ્ન મંડપ માંથી, દિનેશભાઈના પગ નજીક મુકેલ સોનાના દાગીના કુલ કિંમત રૂપિયા ૭,૦૨,૦૦૦/- મતાના ભરેલ થેલી દિનેશભાઈની નજર ચુકવી ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.વી.પટેલ ચલાવે છે.

વટવા : અલ્પેશકુમાર કાંતિલાલ રાય (ઉ.વ.૩૭)(રહે. આનંદ ટેનામેન્ટ સ્મૃતિ મંદિરની સામે ઘોડાસર વટવા) એ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૨/૧૯ બપોરના ૧/૦૦ થી સાંજના ૬/૩૦ વાગ્યા દરમિયાન પોતાના મકાન ના ઉપરના માળે ખુલ્લા રૂમની તિજોરીમાંથી કોઈ અજાણી વ્યક્તિ સોનાના દાગીના તથા ચાંદીના સિક્કા મળી કુલ રૂપિયા ૧,૯૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એમ.દેસાઈ ચલાવે છે.

શાહીબાગ: કપિલાબહેન પ્રહલાદભાઈ પટેલ (ઉ.વ.૫૧) (રહે. કુશલવાટીકા એપાર્ટમેન્ટ હાથી સર્કલ પાસે શાહીબાગ) એ અગમ્ય કારણસર તા.૧૧/૨/૧૯ સવારના ૧૧/૦૦ થી બપોરના ૧/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી અજીતસિંહ ચલાવે છે.

મણીનગર: કોકીલાબહેન રાજુભાઈ યુનારા (ઉ.વ.૪૫) (રહે.બળીયાકાકાનગર ચાલી જુના ઢોર બજાર હેડગેવરની બાજુમાં કાંકરિયા,મણીનગર) એ બિમારીથી કંટાળી તા.૧૧/૨/૧૯ કલાક ૧/૪૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લીધું હતું. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી ટી.એન.મોરડિયા ચલાવે છે.

નારોલ: (૧) વિજયકુમાર સંતરામ તિવારી (ઉ.વ.૩૬) (રહે.આકૃતી આંગન ફ્લેટ સનરાઈઝ હોટલ પાછળ લાંબા નારોલ) એ અગમ્ય કારણસર તા.૧૧/૨/૧૯ રાતના ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે લોખંડની એંગલ સાથે કાપડની દોરી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ઇન્તેખાબઆલમ મુખતારહસન ચલાવે છે.

નારોલ: (૨) યશભાઈ રતીલાલ મિસ્ત્રી (ઉ.વ.૨૫) (રહે. સત્કાર હોમ્સ શ્રીરામ રેસીડન્સીની પાસે નારોલ અસલાલી હાઇવે નારોલ) એ અગમ્ય કારણસર તા.૧૧/૨/૧૯ સાજના ૫/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં ચાદર બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી શંકરભાઈ હિરજીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.